

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૯/૦૮/૨૦૧૭ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૬૬૮/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૯ કેસ કરી, ૨૫ વ્યક્તિઓને ઝડપી, ૨૧૦ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૧ કેસ કરી ૩ વ્યક્તિઓને ઝડપી જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૬૯/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૩૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી.તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૬૭૦/૧૭

**દાણીલીમડા:** કૃષ્ણકાંત સોમાભાઈ પરમાર (ઉ.વ.૭૬) (રહે.શ્રીધર સોસાયટી કમલ કેલેન્ડરની પાસે દાણીલીમડા) એ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૮/૧૭ બપોરના ૧૨/૦૦ વાગ્યાના સુમારે કૃષ્ણકાંત પરમારના ઘરે બે પુરૂષો આવ્યા હતા. જેઓએ સેલ્સમેન છીએ અને અમે કંપનીની જાહેરાત માટે આવેલ છીએ અને વીમ પાવડરથી સોના-ચાંદીના દાગીના ધોઈ તેને ચમકાવી આપીએ છીએ તેમ જણાવી કૃષ્ણકાંતના પત્ની પાસેથી સોનાની બંગડી નંગ-૨ કિમત રૂપિયા ૩૪,૩૪૦/-, સોનાની ચેઈન કિમત રૂપિયા ૧૯,૯૭૦/-, સોનાની વિંટી નંગ-૧ કિમત રૂપિયા ૪,૨૮૨/-, કાનમાં બુટ્ટી નંગ-૨ કિમત રૂપિયા ૬,૧૬૯/- અને સોનાની વિંટી કિમત રૂપિયા ૩,૯૪૧/- મળી કુલ રૂપિયા ૬૮,૭૦૨/- મતાના દાગીના ચમકાવી આપવાનું કહી વિશ્વાસમાં લઈ યુક્તિ-પ્રયુક્તિ કરી છેતરપીંડી કરી પલાયન થઈ ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.એસ.પરમાર ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૬૭૧/૧૭

**સોલા હાઈકોર્ટ:** સપનાબહેન રાહુલચંદ્ર જૈન (રહે, વિનાયક હાઇટસ, તીરુપતી સ્કુલ સામે, ચાંદલોડીયા, સોલા) એ તા.૧૮/૮/૧૭ નારોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩/૮/૧૭ સાંજના ૬/૦૦ થી તા.૫/૮/૧૭ બપોરના ૨/૩૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૨૬,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.રાજપુત ચલાવે છે.

સોનાનો ઘોરો ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૧૬૭૨/૧૭

ઘાટલોડીયા: પ્રવિણાબહેન વા/ઓ બીપીનચંન્દ્ર ઠાકર (ઉ.વ.૭૭) (રહે. મધુવુંદ સોસાયટી સ્વીપાર્ક કે.કે.નગર પાસે ઘાટલોડીયા) તા.૧૮/૮/૧૭ સાંજના ૫/૪૫ વાગ્યાના સુમારે રહેણાંકની સોસાયટી નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટીવા ઉપર આવેલ પુરૂષ પ્રવિણાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ પ્રવિણાબહેન ઠાકરે ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી અજીતસિંહ કુલસિંહ ચલાવે છે.

શાહીબાગ: રમીલાબહેન વા/ઓ જગદીશચંન્દ્ર લિબાચીયા (ઉ.વ.૬૨) (રહે. નીલકંઠ પાર્ક ઘોડાકેમ્પ શાહીબાગ) તા.૧૮/૮/૧૭ કલાક ૭/૧૫ વાગ્યાના સુમારે શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલ રોડ અનમોલ ટાવર સામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) બે પુરૂષ રમીલાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ રમીલાબહેન લિબાચીયાએ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.એલ.ચૌહાણ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૬૭૩/૧૭

રામોલ: તેજેન્દ્રસિંહ રામપ્રતાપસિંહ ચૌહાણ (રહે. ચૌહાણ પેલેસ સત્યનારાયણનગર અમરાઈવાડી) એ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૮/૧૭ કલાક ૧/૩૦ વાગે વસ્ત્રાલ રીંગરોડ વસ્ત્રાલ ચાર રસ્તા તેજેન્દ્ર કિસ્ટલ નજીક પાર્ક કરેલ પોતાનું ટાટા ડમ્પર નંબર ૨૭ વી ૪૪૪૯ કિંમત રૂપિયા ૧૬,૦૦,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એચ.બી.બાલીયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.